

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ

इहानी ईलाज



-: संपादक :-

अलीइअे शैभुल ईस्लाम

डाज्ठ ईब्राहीम भाई वदीयावाला



ફઝીલત : હઝરતે અબૂ દરદા رضي الله تعالى عنه થી રિવાયત છે કે જે માણસ આ આયતને દર રોજ સૌ (100) વખત પઢશે પૂરી દુનિયા અને આખિરત એને કાફી થઈ જશે.

❀❀❀ 16 ❀❀ બદકારી અને ઝિનાથી હિફાઝત માટે ❀❀❀

بِسْمِ اللَّهِ الرَّحْمَنِ الرَّحِيمِ يَا حَيُّ يَا قَيُّمُ
بِرَحْمَتِكَ أَسْتَغِيثُ أَصْدِحْ لِي شَأْنِي كُلَّهُ
وَلَا تَكِلْنِي إِلَى نَفْسِي طَرْفَةَ عَيْنٍ-

બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ

યા હય્યુ યા કય્યૂમુ બિરહ્મતિક અસ્તગિષુ, અસ્લિહ લી શઅ્ની કુલ્લહૂ વલા તકિલ્ની ઈલા નફ્સી તર-ફત અય્નિન્.

ફઝીલત : જો કોઈને શહવતનો (વધારે પડતો) ગલ્બો (પ્રભાવ) હોય અને તેને ઝિના યા બદકારીમાં સપડાઈ જવાનો ભય હોય તો ઉપરોક્ત દુઆને અઢાર (18) વખત દર રોજ પાબંદીની સાથે પઢયા કરે. શરૂઆત અને છેવટમાં ત્રણ ત્રણ વખત દુરૂદ શરીફ પઢવું. إِنْ شَاءَ اللَّهُ શહવત ઓછી થઈ જશે અને બદકારી (ઝિના)થી હિફાઝત થશે.

❀❀❀ 17 ❀❀ દુશ્મન પર તજર પડે તો આ દુઆ પઢે ❀❀❀

يَا مَالِكِ يَوْمِ الدِّينِ أَيَّاكَ نَعْبُدُ وَأَيَّاكَ نَسْتَعِينُ-

યા માલિક-ક યૌમિદ્દીનિ, ઈય્યા-ક-નઅબુદુ વ ઈય્યા-ક-નસ્તઈન

❀❀❀ 18 ❀❀ મક્સદમાં આસાની માટે ❀❀❀

ફઝીલત : જુમ્આના દિવસે જુમ્આની નમાઝ પહેલાં પાક સાફ થઈને એકાંતમાં અલ્લાહ અલ્લાહ પઢવાથી (જે મક્સદથી પઢવામાં આવશે તે)

યૌથા શ્વાસમાં! **يَا حَيُّ يَا قَيُّوْمُ** یا હચ્યુ યા કચ્યૂમુ જેટલી વખત વધારે પઢી શકાય.

પાંચમાં શ્વાસમાં! **يَا رَحْمٰنُ** یا રહમાનુ યા રહીમુ જેટલી વખત વધારે પઢી શકાય.

છઠ્ઠા શ્વાસમાં! **يَا رَحِيْمُ** યા રહીમુ યા રહીમુ જેટલી વખત વધારે પઢી શકાય.

સાતમાં શ્વાસમાં! **يَا اَرْحَمَ الرَّاحِمِيْنَ** યા અર્હમરહિમીન જેટલી વખત વધારે પઢી શકાય.

ઉપરના અસ્માઉલ હુસ્ના ખત્મ થતાં સુધી પઢતા રહે. એ પછી પોતાની ઝરૂરતના માટે દુઆ કરે તો **اِنْ شَاءَ اللهُ** તેની હાજત (ઝરૂરત) પૂરી થશે. આ ઈમામ જાફર સાદિક **رَضِيَ اللهُ تَعَالَى عَنْهُ** ની દુઆ છે. આ દુઆને સબ્બે અસ્માએ હુસ્ના પણ કહેવામાં આવે છે. શરૂઆત અને છેવટમાં દુરૂદ શરીફ પઢવું.

❀❀❀ 40 ❀❀❀ સાંપના ડંસ માટેનો ઈલાજ ❀❀❀

ફઝીલત : સાંપના ડંસને ઉતારનાર માણસ જે વ્યક્તી ને સાંપ યા વીંછીએ ડંસ માર્યો છે તેને પૂછે કે દર્દ કઈ જગ્યાએ છે ? જ્યાં તે દર્દની જગ્યા બતાવે તે જગ્યા પર છરી મૂકીને અમુક વખત આ દુઆ પઢે, પછી એ છરીને ઉપરથી નીચે તરફ સરકાવે અને એ દરમિયાન વારંવાર આ દુઆ પઢતો રહે. ત્યાં સુધી કે દર્દ ઉપરથી ઉતરીને નીચેની તરફ આવી જાય તો એને મોંઢાથી ચુસીને થુકી દે. **اِنْ شَاءَ اللهُ** ઝહેર ઉતરી જશે. શરૂઆત અને છેવટમાં દુરૂદ શરીફ પઢવું.

તે દુઆ આ છે :

سَلَامٌ عَلَى نُوحٍ فِي الْعَالَمِينَ وَعَلَى مُحَمَّدٍ فِي
الْمُرْسَلِينَ مِنْ حَامِلَاتِ السَّمِّ أَجْعِلِينَ-

સલામુન અલા નૂહિન ફિલ આલમીન વ અલા મુહમ્મદિન ફિલ મુર્સલીન મિન હામિલાતિસ્સમ્મિ અજમઈન.

❀❀❀ 52 ❀❀ વધુ પડતી ઊંઘ આવતી હોય તો... ❀❀❀

જો કોઈને ઘણી જ ઊંઘ આવતી હોય તો સૂતી વખતે આ આયત પઢી લે. **إِنْ شَاءَ اللَّهُ** ઊંઘનો ગલ્બો ઓછો થઈ જશે. શરૂઆત અને છેવટમાં દુરુદ શરીફ પઢવું.

إِنَّ رَبَّكُمُ اللَّهُ الَّذِي خَلَقَ السَّمَوَاتِ وَالْأَرْضَ فِي سِتَّةِ أَيَّامٍ ثُمَّ اسْتَوَىٰ عَلَى الْعَرْشِ ۚ يُغْشَىٰ اللَّيْلَ النَّهَارَ يَطْلُبُهُ حَثِيثًا ۖ وَالشَّمْسُ وَالْقَمَرُ وَالنُّجُومُ مَسْكُورَاتٌ ۖ بِأَمْرِ ۖ أَكَلَهُ الْخَلْقُ وَالْأُمُرُ ۗ تَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ ۝

ઘનન ૨૦૦-કુમુલ્લાહુલ્લાગી ખલકરસમાવાતિ વલ અર્દ ફી સિતતિ અચ્યામિન સુમ્મસ્તવા અલલ્ અર્શિ, યુગ્શિલ્ લયલન્નહા-ર યત્લુબુહૂ હષીષંવ્ વશશમ્શ, વલ ક-મ-ર વન્નુખૂ-મ મુસખ્ખરાતિમ્ બિઅમ્રિહી અલા લહુલ ખલ્કુ વલ અમ્રુ તબારકલ્લાહુ ૨૦બુલ આલમીન. (સૂરએ અઅરાફ : પારહ : 8, આયત નં : 54)

أَدْعُوا رَبَّكُمْ تَضَرُّعًا وَخُفْيَةً ۗ إِنَّهُ لَا يُحِبُّ الْمُعْتَدِينَ ۗ وَلَا تُفْسِدُوا فِي الْأَرْضِ بَعْدَ إِصْلَاحِهَا ۚ وَأَدْعُوهُ خَوْفًا وَطَمَعًا ۗ إِنَّ رَحْمَةَ اللَّهِ قَرِيبٌ مِّنَ الْحَسِينِ ۝

ઉદ્દી ૨૦બકુમ તદરુઅંવ્ વ ખુફ્યતન્, ઘનનહૂ લા યુદ્દીબુલ મુઅતદીન. વલા તુફ્ફિદૂ ફિલ અર્દિ બઅદ ઇસ્લાહિહા વદ્દીહુ ખવફંવ્ વ-ત-મ-અન ઘનન રહમતલ્લાહિ કરીબુમ્ મિન મુહસિનીન.

(સૂરએ અઅરાફ : પારહ : 8 આયત નં. 55-56)

❀❀❀ 53 ❀❀ મિર્ગી (ખેંચની) બીમારી ❀❀❀

મિર્ગી (ખેંચની) બીમારીના મરીઝના માથા પર આ આયત ત્રણ (3) વખત લખીને બાંધવી ફાયદા કારક છે.

إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابٌ جَهَنَّمَ ۖ وَلَهُمْ عَذَابٌ الْحَرِيقِ ۝

मिशन का मकसद कौम की जिदमत

अम्नो मडुब्बत की छांव में, जिदमत सुब्बो शाम करें,
आओ ! उम सब मिलजुल कर , पैगामे नबी को आम करें.



:- मिलने का पता :-

मकतबअे शैफुल ईस्लाम, अलिफ़ किराना के सामने,

रसूलाबाद, शाडे आलम अडमदाबाद-380028

और मोडसिने आजम मिशन की तमाम भ्रान्थें

कोन्टेक्ट : 96 24 22 12 12